

ભાગબ્ધાવળી :: ત્રીજી પ્રેરણી :: ૬

શ્રી હીરવિજયસૂરિ

: લેખક :

ધીરજલાલ ટોટોરસ્થી રાહુ



:: ભાગબ્ધાવળી કાર્યાલય, અમદાવાદ ::

ખાળાંથાવળી ત્રીજ એણ્ટિ દ.

શ્રી હીરવિજયસૂરિ

: લેખક :

ધીરજથાત ટેક્સટી શાહ.

સર્વ હક્ક સ્વાධીન

આષ્ટત્તિ પહેલી ∴ સંવત ૧૬૮૭
મુલ્ય સવા આનો.

અ કા સા કઃ:-

ધીરજલાલ ટોકરરેણ શાહ
ચિત્રકાર, ખુલ્સેલર એન્ડ પણ્ઠીશર,
રામપુર : હનેવીની પોળ,
: આ મ હા વા દ. :

સુ દ્ર કઃ:-

મૂળયં દ્વારા વીકમદાલ પટેલ
સુર્યપ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ
પાનકાર નાંદા—અમદાવાદ.

શ્રી હીરવિજય સૂરિ.

આજનું પાતણુપર જુના વખતમાં પ્રહૃતાદનપુર કહેવાતું કારણુ કે તેને વસાવનાર પરમાર ધારાવર્ષનો પુત્ર પ્રહૃતાદનહેવ હતો.

જગચ્ચયંક્રસ્તસ્ત્રિના સમયે જૈનોતું ત્યાં એટલું પૂર હતું કે પ્રહૃતાદનપાર્વતીનાથના મંદિરમાં મૂડાચેલી સોપારીઓ સોળ મણું થતી ને ચોખા તો એક સુડો થતા. જૈન સમાજને આ નગરે એ અમૃતય રત્નેની લેટ આપી છે-એક મહાન પ્રભાવક સોમસુંદરસૂરિ ને ધીજા શ્રીહીરવિજયાલુ.

આ વાતમાં શ્રીહીરવિજયજીનું જીવનચરિત્ર જોઈએ. વિકલ્પની સોળમી સહીમાં આ નગરમાં કુંરશાહ નામે એક ધર્મપ્રેમી ઓશવાળ હતો. તેમને નાથી નામે અતિ શુણુયલ પત્ની હતી. તેમને સંઘળુ, સૂરજ ને શ્રીપાળ નામના ત્રણુ પુત્રો હતા. રંલા, રાણી ને વિમળા નામે ત્રણુ પુત્રીઓ હતી. એક વખત નાથીબાઇ સુખે શૈચામાં પોઢ્યાં હતાં ત્યારે સિંહનું સ્વભન આંધું ને ગર્ભ રહ્યો. પૂરા દિવસે પ્રસવ થયો. ત્યારે હેવખાળ જેવો પુત્ર અવતર્યો. સં. ૧૫૮૮ ના માગસર સુહ દ નો એ દિવસ હતો. અંધારામાં જેમ હીરો પ્રકાશો તેમ ઘર આખામાં તેનો પ્રકાશ પહ્યો. આથી માતાપિતાએ એમનું નામ હીરજ રાખ્યું. સહુથી એ નાનો એટલે માતાપિતાને લાડકવાયો થયો અને ભાઈ બહેનોતું હેત પણ તેનાપર ઉલરાવા લાગ્યું. આમ કરતાં હીરજ પાંચ વર્ષનો થયો.

ભાગુતર વિના શ્વરતર નકાસું એ માણાપ સારી
રીતે સમજતા હતા એટલે તેને નિશાળે મૂક્યો અને
ધાર્મિક ભાગુંવવા ત્યાગી સુનિરાજ આગળ મોકદવા લાગ્યા.

એક વખત હીરળએ ચોતાના પિતાને પૂછ્યુઃ
પિતાલ ! આપણા કુળમાંથી કોઈ સાધુ થયું છે ?

“ ના એટા ! તને એવો સવાલ કર્યાંથી થયો ? ” કુંરા-
શાહે જરા આતુરતાથી પૂછ્યું. “પિતાલ ! ને કુળમાંથી
એક પણ સાધુ નથી થયો તે કુળ શા કામતું ? કોઈકિ
સાધુ થઈને એને દીપાવલું જોઈએ.”

પિતાના મનમાં ઉંડે ઉંડે વિચાર આવ્યોઃ જરૂર
આ છોકરે કોઈક દિવસ સાધુ થશે.

બાર વર્ષની ઉંમરમાં તો હીરળ ખુલ લાગ્યો
ગણ્યો. ને ચોતાની ઉંમરના ખાળકોમાં જુહોઝ તરી
આવ્યો. એવામાં કુંરાશાહ તથા નાથીબાઈ મરણ પામ્યાં.
હીરળ તથા લાઈબહેનોને શોક થયો, પણ શોક કર્યો શું
વળે ? સમજુ થઈને સહુએ મનને કાણુમાં રાખ્યું.

બહેનનાં વહાલ અનેરાં હોય છે. પાઠળથી રાણી તથા
વિમળા બહેન આવ્યાં હતાં તેમણે કહ્યુઃ લાઈ ! હુવે આ
ધરમાં રહ્યું શે જશે ? માટે પાઠળ ચાલ. અમારી સાથે રહેને
ને મજા કરને. બહેનના હેતને વશ થઈ હીરળ પાઠળ ગયો.
હીરળને ધર્મના સંસકારો ઉંડા હતા, એથી તેને સાર્દ
સાર્દ વાંચવાનું ને સુનિમહારાજના વ્યાખ્યાન સંભળ-
વાનું બહુ ગમતું. બીજાનીને મનકામી વાતોમાં કે ટેલ-
ટ્રાપમાં તે વખત શુમાવતો નહિ. તે હંમેશાં પ્રભાતમાં
વહેલો ઉઠી નવકાર મંત્ર લાણી, નાહીને સેવાપૂજન કરતો

૫

ને પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રેણ જતો. એ અરસામાં શ્રીવિજયદાનસૂરી ઉપરેશ આપતાહતા. ધીરેધીમે એ ઉપરેશની હીરળને સચ્ચોટ અસર થઈ ને તેણું સંસાર વ્યહારમાં પડવા કરતાં દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરવાનું નક્કો કર્યું.

એક હિવસ તેણું કહ્યું: “વિમળા બહેન! મને સંસારમાં ગોઠનું નથી માટે દીક્ષા લેવી છે. વિમળા સમજું ને શાણી હતી. તેને વિચાર થઈ પડ્યો, લાઈ જેવા લાઇને એકદમ દીક્ષા લેવાની કેમ રજા આપાય? ત્યારે પરમ પવિત્ર દીક્ષા લેવાની ના પણ કેમ પડાય? આ તો સુડી વચ્ચે સેપારી થઈ એટલે તેણું જવાબ જ ન આપ્યો. હીરળ વિચારમાં પડ્યો: બહેન જવાબ કેમ નથી આપતાં. થોડા હિવસ પછી તેને સમજાયું કે એણું ના નથી પાડો એટલે હાજ સમજવી. એથી ૧૫૮૬ ની સાતવારાં કારતક વહ ૨ ને હિવસે વિજયદાનસૂરી આગળ દીક્ષા લીધી. એમનું નામ પાડવામાં આવ્યું હીરહર્ષ.

૩

હીરહર્ષ સુનિને થયું કે હું તો ખુઅ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. સાધુ થઈને બરાબર જાન ન મેળવીએ તો શું કામનું? આથી તેમણે ખુઅ ખાંતથી શાસ્ત્રનો અભ્યાસ કર્યો. પછી વિચાર આવ્યો આ બધા શાસ્ત્ર લણ્યો પણ ન્યાયશાસ્ત્ર જોઈએ તેવું નથી જણ્યો. માટે લાવો ડોઈ એવા ડેકાણે જધને અભ્યાસ કરું કે એમાં પણ પારંગત થાડે.

એ વાખતે દૃક્ષિણ દેશમાં દોલતાખાદ યાને હેવગિ-

૬

રિમાં મોટા મોટા ન્યાયશાખના જ્ઞાણુકાર પદિતો પડયા હતા. હીરહર્ષસુનિ ધર્મસાગરલું અને રાજવિમળ નામના એ સાધુઓએ જાથે ત્યાં ગયા ને ન્યાયશાખનો ખુલ સારો અભ્યાસ કર્યો.

૪

જાની ન હોય માની એ પ્રમાણે હીરહર્ષ સુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયો ને વધારે નામ થયા. ગુરુએ દેખ્યું કે આ શિષ્ય ધરાળર પંડિત કહેવાને ચોણ્ય છે એટલે પહેલાં એમને પંડિતપદ આપ્યું ને પછી ઉપાદ્યાય પદ આપ્યું. એ પદની એમણે શોભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ પ ને હીવસે શીરોહીમાં મોટો ઉત્સવ કરી તેમને આચાર્ય ઘનાવ્યા. હવે તેઓ હીર-વિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા.

શિરોહીથી વિડાર કરતા તેઓ પાઠણ આવ્યા, ત્યારે ભારે પાઠમહેત્સવ થયો ને તેમને પદૃધર અનાવ્યા. આ પ્રસંગ પછી થોડા વખતમાં શુરુજીનો સ્વર્ગવાસ થયો એટલે સંબ આખાની જોખમહારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ જોખમહારી એમના માથે ઉડાવી જુદા જુદા ગામમાં ઝરવા લાગ્યા ને સચ્ચેએ ઉપરેશ આપી માણુસોનું અજ્ઞાન ઝર કરવા લાગ્યા. એમ કરતાં કે કાંઈ આ વખતે સંકટો આવ્યાં તે સહી લીધાં. શુજરાતમાં સુસલમાણી રાજ્ય હતું ને દિલહીથી નિમાયેલા સુખા રાજ્ય કરતા હતા. એ સુખાએ કાનના ડાયા હોચાથી ધણા સારા માણુસોને પણ સહન કરવું પડતું હતું. કે કોઈ માણુસ

૭

સુખાના કાન લંબોરી શકે તે ધાર્યું કરાવી શકતો.

એક વખત સૂરિલું અમહાવાહ આવ્યા. ત્યાં ડેઢિએ જઈને સુખા શિહાબખાનને કહ્યું: પરવરદિગાર ! આ હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે એટલે વર-સાહ પડતો નથી. “હું એસા ? જવ ઉસકે ખુલાવ” સુખાએ હુકમ કર્યો.

હીરવિજયસૂરિને સભામાં હાજર કર્યો. સુખો કહે, મહારાજ ! આજકાલ વરસાહ કેમ પડતો નથી ? શું આપે બાંધી લીધો છે ? સૂરિલું કહે, અમે શા માટે બાંધી લઈએ ? વરસાહ નહિ આવવાથી લોકો હુંઘી થાય ને લોકો હુંઘી થાય તો અમને પણ કયાંથી શાંતિ મળે ? ‘એસા’ ? સુખો વિચારમાં પડ્યો. એવામાં શહેરના પ્રસિદ્ધ શેઠ કુંવરલું આવ્યા. તેમણે કહ્યું: મહારાજ ! એતો ફરીર છે. બહુ ખાનદાન ને સારી રીતભાત વાળા છે વગેરે. સુખાએ આથી તેમને છોડી ભૂક્યા. સૂરિલું ઉપાશ્રેણે આવ્યા એટલે લોકોને ખુખ આનંદ થયો. એ આનંદ અતાવવા ખુખ હાન કરવામાં આંદું. એમાં એક તુરકી સિપાઈને કુંવરલું શેઠ જેડે જભી ગઈ. એણે વિચાર કર્યો કે આતું વેર વાળલું. એથી શાડા દિવસ બાદ તેણું કોટબાળના કાન લંબેર્યો ને તેણું જઈ ખાનને કહ્યું: સાહેખ એ હીરવિજય તો એસા હૈ તેસા હૈ. ખાન કહે, પકડી લાવો એને.

શું ન્યાય ! શું બુદ્ધિ ! એક લંબેરણી માત્રથી આવા મહાપુરુષને પકડવાનો હુકમ આપ્યો. જેવા ખાન એવા સિપાઈએ. એ લાંખી ઢાઢીબાળા સિપાઈએ. હેડ્યા

८

ને જવેરી વાડમાંથી શ્રી હીરવિજયલસ્ફુરિને પકડ્યા. આ વખતે પાસેના માણુસો પણ થરથરવા લાગ્યા. એમાં એ બહાદુર નીકળ્યાઃ એક રાધવ ગંધર્વ ને ધીન સોમ સાગર. એમણે બરાબર એ સિપાઈઓને સામને કર્યો ને હીરવિજયલને છોડાવ્યા. હીરવિજયલ અહીંથી ઉધાડા શરીરે એક સહીસવામત સ્થગમાં ચાલ્યા ગયા.

સિપાઈઓ પાછા ઝર્યા ને બૂમ પાડતા પાડતા પાછા આવ્યા. હીરલ નારી ગયો—અમને મુઢીએ મુઢીએ માર્યા. ખાન આ સાંસળી રાતો પીણો થયો. વધારે સિપાઈઓને મોકલી કલ્યાં : જલ જયાં હેઠાં ત્યાંથી હીરવિજયને પકડી લાવો. શહેરમાં આ વાતની અભર પડતાં ફોટોફોટ પોણોના દરવાજા બંધ થયા ને શોરબકોર મચી રહ્યો. સિપાઈ-ઓએ સ્ફુરિલને શોધવામાં કચાચ રાખી નહીં છતાં પણ તેમાં ઝોવ્યા નહીં. બીજા એ લગતા જ સાધુઓને પકડીને મારવા માંડ્યા. પણ પછી એમને અભર પડી કે આતો ધર્મસાગર ને શુતસાગર નામના બીજાજ સાધુઓ છે. આ અધી ધમાલ પતી ગયા પછીજ હીરવિજયલ શાંતિથી વિહાર કરી શક્યા. આવી આવી મુશ્કેલીઓ તેમને ત્રણ ચાર વખત સહન કરવી પડી છે. તેઓ નિરંતર કાંઈ ને કાંઈ તપ કરતા હતા ને સંયમતું બરાબર આ-રાધન કરતા હતા.

૫

હિંહુસ્તાનના ધધા બાદશાહોમાં અકબરે નામ કાઠર્યુ છે. એ પ્રતાપી ને અળવાન હતો. એ મહા ચતુર ને સુસહી હતો. વળી જુદા જુદા ધર્મની વાતો સાંભળવાનો.

૬

તે તેને ભારે શોખ હતો. એણે ઇત્તેહસુર સિકીમાં એક એકદંડીએ મહેલ બાંધ્યો હતો અને ત્યાં બધા ધર્મના માણસોને બોલાવી નુહી નુહી બાખતો પર ચર્ચા કરાવતો હતો.

એક વખત તે પોતાના મહેલમાં એસી નગરચર્ચા જેઈ રહ્યો હતો તે વખતે એક વરધોડો જતો જેથો. તરતજ પાસે ઉલેલા નેકરને પૂછ્યું: આ ધામધૂમ શેણી છે? તેણે કહ્યું: જહાંપનાહ! ચાંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યા છે. એ ઉપવાસ એવા છે કે જરૂર પડે ત્યારે ઇકત દિવસે જ ગરમ પાણી પી શકાય. બીજુ કોઈ વસ્તુ મોંબાં નંખાય નહિ. એના ઉત્સવ નિનિસે આ વરધોડો નીકળ્યો છે. “છ મહિનાના ઉપવાસ? કયા બાત હૈ!” અકથરને આ વાત સાંલળી નવાઈ લાગી, કારણું તે જાણ્યો હતો કે એક મહિનાના રોજ કરવામાં રાત્રે ચેટ લરીને ખાવાની શૂટ છે છતાં કેણું આકર્ષ લાગે છે! આ તે સાચું કેમ હોઈ શકે? તેના મનમાં શાંકા થઈ અને એ વાતની ખાતરી કરવા એ માણસોને ચાંપાને ત્યાં મોકલ્યા. તેમણે આવીને પૂછ્યું અહેન! તમે આટલા બધા દિવસો સુધી બુઝ્યાં કેમ રહી શકો છો? અમે તો એક દિવસમાં બુલ્લ ઉડીએ છીએ. તેણે કહ્યું: વીરા! તમારી વાત સાચી છે. આટલા ઉપવાસ કરવા એ ખુબ સુશક્લ છે પણ હું તો મારા શુલ્ક હીરવિજયલના પ્રતાપથી સુધે કરી શકું છું. એમણે આવીને બાદશાહને વાત કરી. બાદશાહને થયું કે શું આવો મહાપુરુષ પણ અત્યારે છે? એ વાતની ખાતરી કરવા તેમણે શુજરાતમાં

૧૦

ખુબ રહેકા એક સુધાને બોલાવીને પૂછ્યું કે તમે હીરવિજયલુને જાણો છો ? તેણે કહ્યું : હા હજુર ! એતો મોટા ફૂલીર છે. કોઈ જતના ગાડી ઘોડા વાપરતા નથી. હંમેશાં પોણ ચાલતા ગામેગામ કરે છે. પાસે ધન રાખતા નથી. ઓરતથી ખુબ દૂર રહે છે ને ઈશ્વરની બંધગી કરી પાક લુધન ગૂળરે છે. બાદશાહને આ વાતથી હીરવિજયલુ માટે ખુબ માન ઉત્પન્ન થયું. ઘોડા હિવસ ભાડ ઓને એક વરઘોડા અર્દખામાં બેઠા બેઠા લેયો ને ટોડરમલ બેઠા હતા તેને હક્કીકત પૂછી. ટોડરમલે કહ્યું : સરકાર ! જે આઇએ તપ કર્યું હતું તે આને પુરું થયું છે. એની ખુશાલીમાં આ વરઘોડા ચડાયો છે. “તો શું ખાઇ પણ એમાં હાજર છે ?” બાદશાહે ઉત્સુકતાથી પૂછ્યું. “જુ હજુર ! એ પણ વન્ધુરાંકારથી સંભળ થઈને પાદખાલીમાં બેઠેકી છે.” આ વાતો ચાલે છે ત્યાં વરઘોડા પાસે આવ્યો. એટલે બાદશાહે ખાનદાન માણસોને મેઝલી ચાંપાખાઈને મહેલમાં આવવાની વિનાંતિ કરી. એ આવી એટલે બાદશાહે પૂછ્યું : તમે કેટલા ઉપવાસ કર્યો ? અને કેવી રીતે કર્યો ?

ચાંપા—મહારાજ ! મેં છ મહિનાના ઉપવાસ કર્યો છે જેમાં કંઈ પણ અનાજ ફુળફળાહિ લીધા નથી. ઇક્તા જરૂર લાગી ત્યારે હિવસના લાગમાં ગરમ પાણી પીધું છે. એ તપ આને પૂરું થાય છે.

બાદશાહ—પણ આટલા બધા ઉપવાસ કેવી રીતે કરી શક્યા ?

ચાંપાએ કહ્યું—મારા ગુરુ શ્રી હીરવિજયલુના પ્રતાપથી. બાદશાહ—એ હાલ ક્યાં વિરાજે છે ?

૧૧

ચાંપા—ગુજરાતના ગાંધાર નગરમાં ખાદશાહે આ વાત સાંલળી તો હતી પણ હવે તો તેને પૂરેપૂરી ખાતરી થઈ. ગમે તેવી વાત સાંલળી હાય પણ નજરે જેવાથી જુદ્ધી અસર થાય છે.

અકબરને થથું કે અત્યારેન હીરવિજયલસૂરિના દર્શન કરે પણ એતો કેવી રીતે જને ? એણે પોતાના એ અકભૂતી ચાલનાર હુતો તૈથાર કર્યા ને તેમને ગુજરાતના સુખા ઉપર એક ફરમાન આપ્યું:-

“હાથી, ઘાડા, પાલખી ને બીજુસામથી સાથે ધામધૂમ પુર્વક શ્રી હીરવિજયલસૂરિને અહીં મોકલ્યો.”

આથાના શ્રાવકોએ પણ એક પત્ર રાજહુતોને આપ્યો.

૬

લાંખી લાંખી એચે કરી અકપથી હુતો અમદાવાદ આજ્યા ને સુખાને ફરમાન પહોંચાડ્યું. એણે અમદાવાદના મોટા મોટા જૈન શ્રીમંતોને એકત્ર કર્યા ને ફરમાન વાંચી સંલાઘયું તથા આથાના શ્રાવકોનો પત્ર આપ્યો. પછી તેણે કહ્યું: ખાદશાહ પોતે આમંત્રણું કરે છે તો તેમે હીરવિજયસૂરિને જવાની વિનંતિ કરો. આવું માન હજુ સુધી કોઈને મહિયું નથી. ત્યાં જવાથી તમારા ધર્મનું ગૌરવ વધશે, અને તમને રસ્તામાં કંઈ અહયણ નહિ પડે એની ખાતરો રાખનો. મને ખુદ હજુને હુકમ છે કે તેમને હાથી, ઘાડા, પાલખી કે ને કંઈ કોઈએ તે આપવા.

જૈન શ્રીમંતોએ કહ્યું: સુરિલુ હાલ ગાંધાર છે માટે અમે ત્યાં જઈશું ને તેમને વિનંતિ કરીને અહીં લાવીશું.

૧૨

૭

ગાંધાર નગરી શ્રી હીરવિજયજીના જ્ઞાન તથા ચાસ્ત્રિથી મુખ્ય થઈ ગઈ છે. તેમનો લાલ લેવાય તેટલો વે છે. વ્યાખ્યાન ચાલો રહ્યું હતું એવામાં અમહાવાદ તથા ખંબાતના આગેવાન શ્રાવકો આવી પહોંચ્યા. તેમણે બધા સાધુઓને વંદન કર્યું ને વ્યાખ્યાન સાંભળવા એડા. સૂર્જિનું એ બધાને નેઈ આનંદ પાણ્યા પણ મનમાં વિચાર કરવા લાગ્યાઃ એકાએક આ અધ્યા કેમ આવ્યા હશે ?

બપોરે જમીને બધા એકાંતમાં એકઠા થયા ત્યારે ખખર પરી કે બાદશાહે તેમને ફૂતેહપુર સિકી તેડાવ્યા છે.

સહુ વિચારમાં પડ્યાઃ આ શું ? અકખર બાદશાહ એકાએક કેમ બોલાવતો હશે ? કોઈ કહે બાદશાહને ધર્મ સાંભળવો હશે ને દર્શન કરવા હશે તો જીતે આવશે. શુરૂ મહારાજને ત્યાં મોકદ્દાય નહિ. કોઈ કહે, અરે એ તો મહાસુસદ્વી છે. એ ઝેણેચુના વચનમાં કેમ વિશ્વાસ રખાય ? કોઈએ આગળ વધીને કહ્યું કે એ તો રાક્ષસનો અવતાર છે. એને માણુસને મારી નાખતાં શી વાર ? કોઈ કહે, એમ તો હોય ? એ ગમે તેવો છે પણ ગુણુનો પૂજક છે. કોઈમાં કંધ પણ ગુણ બુઝે તો શ્રીદા શ્રીદા થઈ જય. માટે શુરૂ મહારાજે જરૂર જવું. કોઈ કહે, એને સોણસો તો રાણીએ છે. બિચારો એમાંથી નવરો પહોંચો ત્યારેજ મહારાજને મળશે ને ! એક જણુ કહે તો પછી જવાની જરૂર જ શી છે ? કેટલાક વધારે સમજુ હતા તેમણે કહ્યું : ત્યાં જવાથી જરૂર આપણું શાસનનો પ્રલાવ વધશો. એવી શાંકાએ કરવાની જરૂર નથી. સૂર્જ-

૧૩

જીએ આ પદ્ધી વાતો સાંલળી એક કુંકું પણ સચ્ચાઈ વ્યાખ્યાન આપ્યું ને પોતાનો અકબર પાસે જવાનો નિર્ણય જાહેર કર્યો. શુભ દિવસે સૂરિજીએ પ્રયાણ કર્યું એ વખતે નગરજનોનાં ટેણેટોળાં વિદાય દેવાને આવ્યાં ને તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. આટલે હુર સૂરિજી જથ્ય છે તેમના દર્શન કરી કર્યારે થશે એજ વિચાર સહુને આવતો હતો.

સૂરિજી અમહાવાદ આંથ્યા ત્યારે સુખાએ તેમને ઓળખાના ને પોતે એક વળત સત્તાંથ્યા હતા તેનો ખુલ પસ્તવો થયો. પદ્ધી તેમની આગળ હીરા, માણેક, મોતી વગેરે ધર્યી પણ સૂરિજીએ તે લેવાની ના પાડી.

થોડા દિવસ અમહાવાદ રહી તેઓ પાઠણ ગયા જ્યાં કેટલાક મંદિરોની પ્રતિષ્ઠા કરી. અહીંથી વિમળ-હર્ષ નામના સાધુ ઉપ સાધુ સાથે આગળ વિહાર કરવા લાગ્યા.

હીરવિજયલ્લસ્તુરીધર અનેક માણસોને પ્રતિબાધ આપતા ને રસ્તામાં આવતા તીથોંની યાત્રા કરતાં આણુ, રાણુકપુર, મેડલા, વગેરે સ્થળે જઈને સાંગાનેર પહોંચ્યા, ત્યારે વિમળહર્ષ વિહાર કરતાં કસ્તેહપુર સિકી પહોંચ્યી ગયા. આગળ જવામાં તેમનો હેતુ એ હતો કે બાહ્યશાહ કેવો છે તે જોવું. કદાચ આપણું અપમાન થાય તો કંઈ નહિ પણ શુલ્ગનું અપમાન તો ન જ થવું જોઈએ. તેઓ ગયા કે તરત થાનસિંધ, માનુકલ્યાણ, અમીપાળ વગેરે જૈન આગેવાનોને કહ્યું : ચાલો આપણું આહશાહને મળીએ. આથી તેઓ જરા ખચકાયા ને કહ્યું : આહશાહ વિચિત્ર પ્રકૃતિનો માણુસ છે. આમ

૧૪

એકાંક્ષેક મળવું ઢીક નથી. આપણે અખુલકાલને
વાત કરીએ. અખુલકાલ એ બાદશાહનો માનીતો
પંડિત હતો. તેણે કહ્યું: એ તો બહુ ખુરીની
વાત. ચાલો, તેમને બાદશાહ પાસે લઈ જઈએ. વિમળ-
હથે તથા ધીજા વણું સાધુએઓ ને અખુલકાલ બાદશાહ
પાસે લઈ ગયો. અને બોલ્યો: “નામદાર! આ મહાત્માએઓ
હૃરવિજયસુરિના ચેલાએઓ છે જેઓને અહીં પદારદ્વા
માટે આપ નામદારે આસં વણું મોકલ્યું છે.” બાદશાહ
એકદમ સિંહાસનેથી ઉડીને બહાર આવ્યો. ઉપાધ્યાય-
જીએ ધર્મદાસ રૂપ આશીર્વદ આપ્યા. બાદશાહ કહ્યું:
મને તે પરમ કૃપાળું સૂરીધરળનાં કયારે દર્શન થશે?
ઉપાધ્યાયજીએ કહ્યું: હાલ તેઓ સાંગાનેર બિરાજ છે
છે અને હવે જેમ બનશે તેમ તેઓ જલ્દી અહીં પદારશે.
અકલ આ સાંભળી ખુખ રાજ થયો.

હૃરવિજયસુરિના આગમનની વાત સાંભળીને
કૃતેહપુર સિકીથી ઘણા શ્રાવકો સાંગાનેર સુધી સૂરિલની
સ્ફૂર્તિ ગયા.

સૂરિલ ત્યાંથી લિંગાર કરી અલિરામાણાદ આવ્યા
ને ત્યાંના સંઘમાં કલેશ હતો તે સમજવટથી દ્વર કર્યો.

પ્રભાતમાં સૂરીલનું બાદશાહી ઠાડથી સામૈયું થયું.
સફળ સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૂરિલ
તરત બાદશાહને મળવા જવા તૈયાર થયા. પોતાની
સાથેના ૧૭ સાધુમાંથી મહા વિક્રિન ૧૩ સાધુએને
સાથે રાજ્યા. બાકીનાને ઉપાશ્રી મોકલ્યા. અખુલકાલ

१५

ने अभर कुलेवडावी के हीरविजयज्ञ बादशाहने मणवा आये छे एटले तेणु जध बादशाहने समाचार पहोंचाइया.

बादशाह कहुः अहो ! केनी हुं लांबा वर्षतथी आहुना करतो हुतो ते आवी पहोंच्या ? भने खुब आनंद थाय छे. पण हमणां हुं खास काममां होवाथी भलेकमां जडूं छुं. त्यांथी आवुं त्यां सुधी तमे एमनी सेवाभक्ति करो.

सूरिलुचे विचार्युः डेवी वात ? पण जे थाय ते साराने भाटे.

एकाएक बादशाहने नहि मणवाथी क्रायदो ज छे. एक वर्षत अकुरना नहादा अखुलझल घर छाप पाडवा हे. तेओआ अखुलझल साथे पूज वर्षत वातचीत करी. अखुलझल पण सूरिलुनी विक्रिताभरी वाणीथी खुश थयो. धर्मचर्चामां लगसग भर्यान्ह काण थर्झ गयो. सूरिलु महातपस्वी हुता. कंधिनि कंध तप तो करता-ज. ते मुज्ज आने आयंभिल हुतुं.

गोवरी भाणी लावी डेई श्रावकने घेर एकांतमां आहुर पाणी करी तेओा निवृत्त थथा. बादशाह पण आई भीने परवायी हुतो एटले उतावणो. उतावणो सूरिलुने मणवा दरभारमां आव्यो. सूरिलु पोतानी मंडणी साथे त्यांज हाजर हुता. बादशाह ए साधु मंडणीने जेझ एकहम सिंहासन छोडी पोताना तणु पुत्रो. साथे बहार आव्यो ने हुथ जेडी घोव्यो :

૧૬

“ મહારાજ ! આપે મહારા જેખા એક સુસલમાન ઉપર ઉપકાર કર્યો. ધણે ફરથી આપને આવંદું પડયું માટે હું ક્ષમા યાચું છું. ભીજું આપને અમહાવાદના સુખાચે હાથી, વોડા તે રથ કંઈ ન આપયું ?

“ નહિ રાજન ! તેણે તો તમારી આજા પ્રમાણે બધું આપયું હતું પણ સાધુ ધર્મના નિયમ પ્રમાણે હું તે વસ્તુએ સ્વીકારી શક્યો નહિ.

બાદશાહ સાધુના આ આચારથી હિંગ જની ગયો. પછી પૂછ્યું : આપ જણુંબણો આપના સુખય તીર્યો કયા કયા છે ?

સૂરિલુએ કહ્યું : શત્રુંભય, ગિરનાર, આણુ, સમ્મેત શિખર, અષ્ટાપદ વગેરે. વળી થોડી થોડી માહીતિ પણ આપી.

પછી બાદશાહની ઈચ્છા સૂરિશ્વરલુની પાસે ધર્મો-પદેશ સાંભળવાની થઈ. તેથી એકાંત શુદ્ધ જગાએ જઈ ગુરુલુએ તેને ધર્મ સમજાયો:

“ ઈશ્વર જન્મ, જરા અને ભરણુથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને નથી, તેમ રોગ, શોક અને ભયથી પણ રહિત હોઈતે અનંત સુખનો અનુભવ કરે છે.

“ જેઓ પાંચ મહાત્માતોનું પાલન કરે, લિક્ષાથી પોતાનો નિવિષ્ટ કરે, સમલાવડ્યપસામાયિકમાં હંમેશાં સ્થિર રહે અને જેઓ ધર્મનો ઉપહેશ કરે તેઓ ગુરુ કર્ણેવાય છે.

“ જેનાથી અંતઃકરણુની શુદ્ધિ થાય-હૃદ્યની પવિત્રતા થાય અથવા વિષયથી નિવૃત્ત થવું-ફર થવું તે જ ધર્મ છે.”

૧૭

આ ઉપરેશી બાદશાહના મન ઉપર સચોટ અસર કરી. તેને લાગ્યું કે મહાત્મા ધર્મના ખરેખરા જાણુકાર છે. પછી બાદશાહે પોતાના પુસ્તકોનો લંડાર મંગાયો અને તમામ પુસ્તકો સૂરિલુની આગળ મૂક્યાં.

એ પુસ્તકો ધર્મનાં હતાં ને ખુબ જુનાં હતાં.

સૂરિલું આથી ઘણું જ આચ્યર્ય પામ્યા. મુસલમાન બાદશાહ વિધમી કહેવાય તે આટલું સાહિત્ય સાચવી રહ્યો છે ? બાદશાહ કહે, મહારાજ ! આ પુસ્તકો સ્વીકારે.

સૂરિલું એ કહ્યું કે અમારાથી જેટલા ઉઠાવાય તેટલા-જ પુસ્તકો અમે રાખીએ છીએ વધારે લઈને અમે શું કરીએ ? પુસ્તકોની જ્યારે અમારે જરૂર પડે છે ત્યારે અમને તે ભળી રહે છે. આટલાં બધાં પુસ્તકો પોતાનાં કરીને રાખવામાં આવે તો મને કે મારા શિષ્યોને ડોધ વણત પણ માલિકીનો લાવ આવી જય. માટે એનાથી ફર રહેલું જ સારું. પણ બાદશાહે બહુ આચહ કર્યો ત્યારે એમના નામનો લંડાર પોલીને એમાં એ રાખવા માટે હા પાડી.

ચોમાસાના દિવસો નજરીક આવવા લાગ્યા. સાધુઓએ એ દરમ્યાન ડોધપણ ટેકાણું સ્થિર રહેલું જોઈએ. આથી સૂરીશર હીરવિજયલું એ ત્યાં ચોમાસું કર્યું.

હુએ ચોમાસામાં પર્યુષણના પવિત્ર દિવસો પાસે આવવા લાગ્યા. સંદે વિચાર કર્યો કે સૂરીશરલું અહીં બિરાજે છે ને બાદશાહ તેમને સારું માન આપે છે તો તેમના હાથે કરોડો જીવને અભયહાન અપાવાએ.

૧૮

એટલે એમના તરફથી સંબન્ધના ડેટલાઈ આગેવાનો આદશાહુ પાસે ગયા. આદશાહુ વિનયપૂર્વક હીરવિજયળના આનંદ સમાચાર પૂછ્યા અને કહ્યું: તેઓએ કઈ મારા લાયક કામકાજ કરમાવયું છે?

આગેવાનો બોલ્યા: પર્યુષણુ પર્વ નજીફીક આવે છે. એ અમારા મહાન પર્વના દિવસો છે. તે દિવસોમાં કોઈપણ માણુસ કોઈપણ જતની હિંસા ન કરે તેવું આપ કરમાન કરો એમ સુરિણુએ કહ્યું છે. આદશાહુ કહ્યું જવ કણુલ છે.

એક વખત અખુલક્ષણ અને સૂરીશ્વરજી જાનની વાતો કરતા હતા. તેવામાં બાદશાહ ત્યાં આવી ચઠ્યા. એ વખતે અખુલક્ષણલે સૂરિણુની વિદ્વતાના સુકૃતકંઠે વખાણ કર્યો.

હવે તો આદશાહુને સૂરીશ્વર ઉપર અથડા શ્રદ્ધા થઈ. એણે મનમાં વિચાર કર્યો કે સુરિણુ ને માગે તે આપું. તેણે કહ્યું: “મહારાજ! આપ અમૂહ્ય ઉપદેશ આપો છો એ ઉપકારનો બદલો. અમારાથી કદી પણ વાળી શકાય તેમ નથી. પણ મારા કલ્યાણને માટે આપ મારા લાયક કર્દી ડામ બતાવશો? સૂરિણુ તો સાચા સાધુ હતા. કંચન, કામિની ને કીર્તિના ત્યાળી હતા. એ બીજું શું માગે? સર્વ જીવા સુખથી રહે એ એમની લાવના. એથી એ દ્વારાના ભંડાર બોલ્યા: બધા પક્ષીઓને પંજરામાંથી છાડી મૂકો. આ ડાબર સરોવરમાંથી માછલાં પુકડવાની બંધી કરો. ન કાયમને માટે પણુસણુમાં હિંસા

૧૯

અંધ થાય તેવું ક્રમાન બહાર પાડો. ગુરુપ્રેરની ખાદશાહે શુલ્કની આજા પ્રમાણે સર્વ કર્યું અને ગુરુપ્રેમ અતાવવા પર્યુષણુના ચાઠ દિવસને બદલે બાર દિવસ હિંસા અંધ કરાવી. તેની સાથેજ પોતે એક વર્ષમાં છ માસ માંસ ખાવાતું છોડી દીધું.

બાદશાહે ક્રમાન બહાર પાડ્યું. આ ક્રમાનથી લોકોમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. સૂરિલુએ બાદશાહને આશ્ર્ય બતાવ્યું અને તેથી તેમણે બાદશાહને પોતાના બનાવ્યા. પરંતુ આ વાયકાઓ સાચી નથી. એ તો જેને જે સમજ્ય તે આદે. પણ ખરી વાત એ છે કે તેમનું ચારિત્ર દ્વારાં ઉંચું હતું. અને જે છાપ ચારિત્રથી પડે તે કાંઈ લાંબા મોટા ભાષણો કર્યો કે ડાળ રાખ્યે શોડી પડે?

એક દિવસ બાદશાહને સૂરિલુએ કહ્યું ક મનુષ્ય માત્રે સત્ય તરફ ઇચ્છિ રાખવી જોઈએ. માણુસ અજ્ઞાન અવસ્થામાં ભુંડા કામે કરી નાંખે છે, પરંતુ જ્યારે તેને સત્યનું ભાન થાય ત્યારે તો સાચ્ચા માર્ગ હુથમાં લેવોજ જોઈએ. પરંતુ જે છે તે ઢીક છે એમ માનીને બેસી ન રહેવું જોઈએ.

બાદશાહે કહ્યું: “ગુરુજી આપની વાત સાચી છે. મેં એક વર્ષમાં છ માસ માંસ ખાવું છોડી દીધું છે અને વળી જેમ બનશે તેમ માંસ ખાવું છોડી દઈશ. હું સત્ય કહું શું કે હવે મને માંસાહાર તરફ બહુ અર્જું થઈ છે.

એક વરણ બાદશાહે પ્રસંગ લાવીને સૂરિલુને પૂછ્યું કે મહારાજ ! કેટલાક લોકો કહે છે કે હાથી મારી

૨૦

નાણે તો અહેતર પણ જૈન મંહિરમાં ન જરૂર એનો શોઃ
અર્થ ? સૂરિજીએ કહ્યું : દરેક ભાણુસ પોતાનેાજ ધર્મ
ઉંચેા ગણે છે. શુદ્ધ દસ્તિએ બીજા ધર્મને તપાસતો
નથી. આતુ પરિણામ જેરવેરને ભારામારી આવી છે.
સૂરિજીની આ વાત સાંલળી પાસે એઠેલા એક પ્રાણીએ
પંડિતને પણ ખુખ અસર થઈ ને તે બોલ્યોઃ મહારાજનું
કહેલું તદ્દન ખરું છે. આવા સાચા મહાત્મા કેટલા હશે ?

આમ અનેક વખત બાદશાહને મળી જુદી જુદી
આખતો સૂરિજીએ સચોટ રીતે સમજાવી.

એક વખત અવસર જોઇને બાદશાહ રાજસભામાં
સૂરિજીને 'જગહણુર'ની પદવી આપી અને એની ખુશાલીમાં
ઘણું પક્ષીએને બંધનથી સુક્તા કર્યો. એ જીવાય હરિણ,
રોજ, સસલાં અને એવા બીજા ધણું જનવરોને પણ
છોડી મૂક્યાં.

સૂરિજીએ અહીં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સિવાય
બીજા પણ ઘણું સુખ્યાએ. પર પ્રભાવ પાડ્યો ને જૈનસમાજ
તથા જીવ માત્રના હિતના ઘણું કામ કરાયા. ગૂજરાતમાંથી
જલ્યાવેરો દૂર કરાયો. સિદ્ધાચયલ, જિરનાર, તારંગા,
આણુ, કેસરીયાળ, રાજગૃહી ને સર્મેતશિખરના ઝાડો
એ જૈન ક્ષેત્રાભદ્રના છે એવું ક્રમાન મેળંયું. સિદ્ધા-
ચયલમાં લેવાતું સુંદરું પણ બંધ કરાયું.

હવે ગૂજરાતમાં પધારવા માટે ખરું દખાણું આવતું
હતું એટલે પોતાની પાછળ મહાવિક્રાન શિષ્ય શાંતિ-
અંદ્રજીને મૂકીને વિહાર કર્યો. રસ્તામાં તેઓ મેડે
પધાર્યો ત્યાં સરોકૃધરજીને એળાખનાર ખાનખાના મળ્યો.

૨૧

તેણે સૂરિલુણું સારું સન્માન કરી પૂછયું કે મહારાજ
ઇશ્વર રૂપી ક્ષમારૂપી.

સૂરિલુ—ઇશ્વર અરૂપી છે.

ખાનખાના—તે અરૂપી છે તો એનો મૂર્તિ શા
માટે કરાવવી ?

સૂરિલુ—“મૂર્તિ એ ઇશ્વરનું સમરણું કરાવવામાં
કારણભૂત છે. મૂર્તિને જોવાથી તેની હાજરી નજર આગળ
દેખાય છે.

ખાનખાના—એ વાત સાચી પણ મૂર્તિની પૂજા
શા માટે કરવી જેહાંએ ?

સૂરિલુ—મૂર્તિની પૂજા કે લોક કરે છે તે મૂર્તિની
પૂજા નથી કરતા પરંતુ મૂર્તિદ્વારા ઇશ્વરની પૂજા કરે છે.

સૂરિલુના આ જવાબથી ખાનખાનાને ધણીજ
પ્રસન્નતા થઈ.

હીરવિજયસૂરીશ્વર મહાન વિચક્ષણુ, શાસનના પ્રેમી
અને જગતનું કલ્યાણ છાચિનાર હતા. અને તેથીજ
તેઓ જેને દીક્ષા આપતા તેને પવિત્ર ઉદેશથીજ
આપતા. તેઓ નિસ્પૃહી અને સાચા ત્યાગી હતા. ધર્મના
સિદ્ધાંતો તેઓ સ્પષ્ટ સમજતા હતા અને તેમના ઉપ-
દેશથી સંખ્યાબંધ મનુષ્યો હીક્ષા લેવા તૈયાર થયા હતા.
તેમને ન હતો શિષ્યોનો લોલ કે ન્હેતી માનની
અભિલાષા. માત્ર જગતના જીવોનું કલ્યાણ કેમ થાય
એજ લાવના રમી રહી હતી.

સૂરિલુએ ધણા લંઘાત્માઓને દીક્ષા આપી ઉદ્ઘાર

૨૨

કંદો હતો અને જૈન ધર્મના ઉપરોક્ત અનાંયા હતા. લગભગ એ હજાર સાધુઓના તે ઉપરી હતા જેમાંના કેટલાક મહાાન કવિ, વ્યાખ્યાની, તાર્કિક, તપસ્વી, સ્વાધ્યાયીને કિચાકાંડી હતા. એમના શિષ્યોએ પણ જૈન શાસનની સેવા કરવામાં ઘણો જ હિસ્સો આપ્યો છે. લૈનોની સંખ્યા એ વખતે લગભગ સાડાત્રણ કોઈની હતી.

આ વખતે ભારતવર્ષમાંથી સુસલભાનોના ધર્મ-અનુભને લીધે અનેક લૈન મંહિરો નષ્ટ થઈ ગયા હતા ને દીર્ઘ દૃષ્ટિ આચાર્યોને એની પુનઃ પ્રતિષ્ઠા કરાવવાની તેગજ નવા મંહિરો નિર્માણ કરાવવાની જરૂર જણુંતી હતી. સૂરીધરણ જેવા દીર્ઘદૃષ્ટિવાળા આચાર્ય-શ્રીએ પોતાના બકો પાસે પાંચસો જેટલા નવાં જૈન મંહિરો અનાવડાય્યા ને પચાસ જેટલાની પોતે પ્રતિષ્ઠા કરી.

સૂરિલુ પાટણુ આંયા ત્યારે તેમને એક સ્વર્ણું આંયું કે ચોતે એક હાથી ઉપર સવાર થઈ પર્વત ઉપર ચઢી રહ્યા છે અને હજારો લોકો તેમને નમસ્કાર કરે છે. સૂરિલુએ એ સ્વર્ણ સોમવિજયલુને કહ્યું. તેમણે બધુ વિચાપૂર્વક કહ્યું: મને લાગે છે કે સિદ્ધાચલની યાત્રા થવી જોઈએ. બન્યું એવું કે સૂરિલુએ જવાનું નક્કી કર્યું એટલે તેમની સાથે પાટણના સંવે જવાનું નક્કી કર્યું ન ગમોગામ કંકાનીએ લખાણી. પછી તો પુછુંજ શું! એકલા ૮૪ તો સંધ્વીએ આંયા. સાધુઓની સંખ્યા એક હજાર થઈ. બધા મળીને એ લાખ માણુસ થયા. તેમણે ભાવપૂર્વક સિદ્ધાચલની યાત્રા કરી. પછી કાઢીએ-

૨૩

વાડમાં વિહાર કર્યો અને કરતાં કરતાં ઉના ગામમાં આવ્યા. સંવત ૧૬૬૧ ની એ સાલ હતી. એ ચોમસામાં એમની તથીયત લથડી અને સંઘે આગળ વિહાર કરવા દીધો નહિ. આ વખતે વિજયસેનસૂરિ લાહોર હતા. તેમને એલાવવા મોકલ્યા. તેઓએ અકથર ધાદશાહની રાજ લઈને ત્યાંથી વિહાર કર્યો. અહીંથાં સુરિણુએ વિજયસેન-સુરિણુની ખુખ રાહ જોઈ કારણું તેમને સંધતું સુકાન સોંપવું હતું. એમ કરતાં પણુસણું પર્વ આંધું. તથીયત ખરાખ છતાં સુરિણુએ કદ્વસ્સુત્ર વાંદ્યુ. લોકોને ઉપરેશ આપવા કરતાં શરીરની કિભૂત વધારે ન હતી. હવે તો સુરિણુના શરીરમાં બિવકુલ શક્તિ ન રહી. સુરિણુએ ધાર્યું કે હવે આચુષ્ય ક્ષણમાં પૂર્ણ થશે એન્દ્રે ચાર શરણો અંગીકાર કર્યાં ને સર્વ સાધુઓને ખમાંયા. સુનિઓને તો આ વખતે કંઈ કુંઈ થઈ ગયું. સુરિણુએ તો પદ્માસન વાજ્યું અને નવકારવાળી હાથમાં લીધી. ચાર માળા પૂરી કરી અને જ્યાં પાંચમી માળા ગણવા જતા હતા ત્યાં તો માળા હાથમાંથી નીચે પડી ગઈ ને જગતનો હૃદો હેઠ છોડી ચાલ્યો ગયો. સંઘે શુરુ વિરહનું વાહણ છવાઈ ગયું. ગામેગામ પાખીએ પડી ને તેમની અન્ત્યકિયાને માટે ઉના અને દીવના સંઘે તૈયારી કરી. તેર ખંડવાળી એક માંડવી, અનાની જાણે હેવવિમાન! કેશર, ચંદન ને ચુઆથી સુરિણુના શરીરને લેપ કર્યો.

બધા લોકોએ ખુખ પૈસા વગેરે ઉછાંયા ને સુરિણુના શણને માંડવીમાં પધરાવવામાં આંધું. તે માંડવી આંધાંવાદિયામાં લાવવામાં આવી. તેમની ચિતામાં પંદરમણું સુખડ, ત

૨૪

મણું અગર, ત શેર કપુર, ર શેર કસ્તુરી, ત શેર કેશર ને
૫ શેર ચુંચો નાંખવામાં આવ્યો. અભિનયો ગુરુના શરી-
રની જગ્યાએ લાસમ રહેવા દીધી. એ જગાની આસ-
પાસની રૂ વીધા જમીન શહેનશહે શ્રાવકેને આપી દીધી.

સુરિણુએ ચેતાની લંઘળીમાં ડેટલી તપસ્યાએ
કરી ? ૮૧ અહુમ, ૨૨૫ છઢુ, ૩૬૦૦ ઉપવાસ, ૨૦૦૦
આચંબિલ, ને એ હળવ નિવી. આ સિવાય તેમણે
વીસસ્થાનકની વીસવાર આરાધના કરી હતી જેમાં
ચારસે આચંબિલ અને ચારસે ચોથ કર્યા હતા. ત્રણુ
મહિના ઉપવાસ, આચંબિલ, નીવી અને એકાસણું આદિ-
માંજ વ્યતિત કર્યા હતા. જાનની આરાધના માટે રૂ
મહિના સુધી તપસ્યા કરી હતી. ગુરુ તપમાં પણ તેમણે
૧૩ મહીના છઢુ, અહુમ, ઉપવાસ, આચંબિલ, અને નીવી
આદિમાંજ વ્યતિત કર્યા હતા. એવીજ રીતે જ્ઞાન, દર્શન
અને ચારિત્રનો આરાધનાનું અગિયાર મહીનાનું અને
૧૨ પ્રતિમાનું પણ તપ કર્યું હતું.

અહા ! આવા તપસ્વી, ત્યાગી, જાની, ઉપહેશક,
સમયના જણું આચાર્યાનું આપણે ડેટલું વર્ષાન કરીએ ?
જૈન સમાજ આ મહા પુરુષના ઉવનને સમજે તો જૈન
સમાજનું ઉજ્જવલ લાવિ દૂર નથી.

ઈલુરાનાં ગુરુભંદિરો

જગત ભરનાં આ અદ્વિતીય ગુરુભંદિરોનો, તથા ઠૌક્ક, શૈવ અને જૈનોના
ઈતિહાસ તથા મૂર્તિબિધાનનો પૂરેપૂરો ઘ્યાલ આપણું સચિન પુસ્તક
આજ દેખકના હાથે બખાદ બહાર પડણું છે. પ્રસ્તાવના દેખક શીયુત
નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. ડિમત આઠ આના. જરૂર
મંગાવીને વાંચો.

:: ખાળ ગ્રંથાવણી ::

| પ્રથમ શ્રેષ્ઠી | બીજ શ્રેષ્ઠી | તૃજ શ્રેષ્ઠી |
|------------------------|----------------------------|-------------------------|
| ૧ શ્રી રીતનહેવ | ૧ અર્જુનમાળા | ૧ શ્રી ભગ્વાહુ સવામી |
| ૨ નેમ-રાણુલ | ૨ અંકવતી સનતુ કુમાર | ૨ શ્રી હેમચદ્રાચાર્ય |
| ૩ શ્રીપાંચનાથ | ૩ ગણેશ શ્રી જૈતમ- સવામી | ૩ શ્રી હરિલદસસુરિ |
| ૪ પ્રભુ મહાવીર | ૪ ભરતમાહુલિ | ૪ શ્રી સિદ્ધસેન હિંબાનુ |
| ૫ વીર ધનનો | ૫ આર્દ્રકુમાર | ૫ શ્રી બાપભંડ સુરિ |
| ૬ મહાત્મા દઢપ્રેહારી | ૬ મહારાજ શેણુક | ૬ શ્રી હીરનિનય સુરિ |
| ૭ અંબયડુમાર | ૭ વીર ભામારાહ | ૭ હૃપાણ્યાય શ્રી યશો- |
| ૮ રાણી ચેત્તાણી | ૮ મહામંતી ઉદ્ઘાયન | વિજયજી |
| ૯ ચંદ્રનાળા | ૯ મહાસતી અંગના | ૮ મહા સતી સીતા |
| ૧૦ ધિલાચીકુમાર | ૧૦ રાજપર્ણ મ્રસનયદ | ૯ દ્રૌપદી |
| ૧૧ જંબુસ્વામી | ૧૧ મયાલુરેહા | ૧૦ નળ દુમયંતી |
| ૧૨ અમરકુમાર | ૧૨ ચંદ્રન મલયાગિરિ | ૧૧ મુગાવતી |
| ૧૩ શ્રીપાળ | ૧૩ કાન કઠિયારો | ૧૨ સંતો ન હયતી |
| ૧૪ મહારાજ કુમારપાળ | ૧૪ મુનિશ્રી હરિકશ | ૧૩ ધન્ય અહિસા |
| ૧૫ પેથડકુમાર | ૧૫ કષિલ મુનિ | ૧૪ સત્યનો જ્ય |
| ૧૬ વિમળરાહ | ૧૬ સેવામૂર્તિ ન હિંદેશ | ૧૫ અસ્તેથનો અહિમા |
| ૧૭ વસુતુપાળ-તેજપાળ | ૧૭ શ્રીરથૂલિલદ | ૧૬ સાચો શાણુગાર-શીલ |
| ૧૮ એમા હેદરાણી | ૧૮ મહારાજ સ પ્રતિ | ૧૭ સુઅની ચાની યાને |
| ૧૯ જગડુશાહ | ૧૯ પ્રભુ મહાવીરના | સતોય |
| ૨૦ ધર્મ માટે પ્રાણુ આ- | ૨૦ હરા આવકો | ૧૮ જૈન તીર્થનો પરિચય |
| પનાર મહાત્માઓ | ૨૦ સવાધ્યાય | લા. ૧ લો. |
| | | ૧૯ જૈન તીર્થનો પરિચય |
| | | લા. ૨ લો. |
| | | ૨૦ જૈન સાહિત્યની ડાયરી |

હેઠ સેટની કિર્મત રૂ. હોઠ તથા વી. પી. પોર્ટલ ૪ ચાના.

બીજનું પુસ્તકો માટે સૂચિપત્ર મંગાવો—

ચિત્રકાર ધીરજલાલ ટોડકરશી શાહ

રાયપુર, હવેલીની પોણ : અમદાવાદ.